

સપ્ટેમ્બર - ૨૦૧૮

અંક - ૧૬



### સંપાદકીય બોર્ડ

- એચ.કે. જોખી
- એસ.જે.મેઢ્ટા
- એમ.એમ.ઠક્કર



### અનુકૂળિકા

શા માટે જનોહી બાળશાળું  
આભૂપણ હહેવાસ છે  
દેહ અણમાંથી મુત્તા  
હશાવે છે જનોહી  
શોગ ઓફ સુધ્યા" લો  
ડો. કલામની દાદ્યાથે બાળશાળ વાદ  
પહેલે દેશનાહિત એટલે શું  
શિક્ષક દિવસ પર (૫ સિતંબર)  
શિક્ષક કી વ્યાખ્યા  
અનેક શેળોમાં ઉપયોગી - દૂસી  
માંથી છદ્રાની તેદ્દા  
શાસ્ત્ર લી પ્રદૂતિશ્યો.



# અરણોદય





બી.પી. દવે  
માધ્યમિક શિક્ષક



# શા માટે જળોઈ બાબુણનું આભૂષણ કહેવાય છે ?

## દ્વેદ અણમાંથી મુક્તદ કરાવે છે જળોઈ

ભૂદેવ માટે ૧૬ સંસ્કાર જરૂરી છે અને તેમાં ઉપનયન સંસ્કાર મહત્વનો છે. ઉપનયન કે જનોઈ એ બ્રાહ્મણ માટે દીક્ષા સંસ્કાર છે. બ્રાહ્મણને દ્વિવજ પણ કહેવાય છે, જેનો બે વખત જન્મ થાય છે તે. જનોઈ સંસ્કાર દ્વારા થતો બીજો જન્મ તે આધ્યાત્મિક જન્મ છે, જેનાથી બ્રાહ્મણનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. યજોપવીત એટલે યજા + ઉપવતી = યજાને પ્રાપ્ત કરનાર. ઉપનયન એટલે ઉદ્ઘર્ગામી કિયા. હકીકતમાં જનોઈ એ ગાયત્રી મંત્રની દીક્ષા છે ગાયત્રી મંત્ર વિનાની જનોઈ એ મૂર્તિ વિનાના મંદિર જેવું છે. પ્રાચીન કાળમાં ઉપનયન સંસ્કાર પછી વિદ્યાર્થીનો ગુરુલુકુળમાં પ્રવેશ થતો. હવે તો જનોઈ પહેલાં વિદ્યાભ્યાસ શરૂ થઈ જાય છે, યજોપવીત સંસ્કાર પાંચમા વર્ષે યા સાતમા વર્ષે કરવો શ્રેષ્ઠ છે.

સોણ વર્ષે યજોપવીત કાળ વીતી જાય છે, તેથી તે પતિત સાવિત્રિક ગણાય છે. જનોઈ બનાવતી વખતે શૂદ્ર દેહ અને શૂદ્ર વસ્ત્ર ધારણ કરી ગાયત્રી મંત્રનું રટણ કરતાં શૂદ્ર કપાસમાંથી. તાર વણવામાં આવે છે. તે તારને જમણા હાથની ચાર આંગળી ઉપર ૮૬ વાર વીટવાના હોય છે, તાર પછી તેને ત્રણ ગણા કરી વળ ચઢાવાય છે. જનોઈ કુલ નવ તારની હોય છે, જેમાં પ્રથમ તાર પર ઓમકાર બીજા તાર પર અહિન, ત્રીજા તાર પર નાગ, ચોથા તાર પર સોમ, પાંચમા તાર પર પિતૃઓ છદ્ધા તાર પર પ્રજાપતિ, સાતમા તાર પર વાયુ આઠમા તાર પર યમ અને છેલ્લા નવમા તાર પર વિશ્વદેવતાઓ બિરાજમાન છે. આમ જનોઈ ધારણ કરવાથી શરીર પર નવદેવતાઓનું શાસન ચાલે છે અને વ્યક્તિને સતત પ્રભુનું સાંનિધ્ય મળે છે. મૂળ ત્રણ તાર એ ગાયત્રી મંત્રનાં ત્રણ ચરણ છે. ત્રણ નાની ગ્રંથિ એ ત્રણ આહુતિ છે અને એક મોટી ગ્રંથિ એ “પ્રણવ” – ઓમકાર છે. વળી જનોઈના છેડાની ગાંઠ એ ધારણ કરનારના ગોત્રમાં થઈ ગયેલા ઋષિઓની સૂર્યક છે. ટૂંકમાં જનોઈ એ વેદમાતા ગાયત્રીનું સ્થૂળ સ્વરૂપ છે.

જીવનના ઉધ્વરીકરણ માટે જનોઈ સંસ્કાર મહત્વનો છે. સમસ્ત સૂણિના આત્મા અને ચાલક બળ એવા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણનો પવિત્ર પ્રકાશ આપણાં બુદ્ધિ વિચારોને પ્રેરણા આપે એ જ ગાયત્રી મંત્રનો અને ઉપનયન સંસ્કારનો ઉદ્દેશ છે. ૨૬ જાન્યુઆરી એ રાષ્ટ્રનો પ્રજાસત્તક દિન છે તેમ શ્રાવણી પૂર્ણિમા એ બ્રાહ્મણનું જનોઈ પર્વ છે. જેમ ચંદ્રક લગાવે, પોસ્ટ, પોલીસ કે રેલવેનો કર્મચારી ઓળખ માટે બિલ્બો લટકાવે તેમ બ્રાહ્મણની ઓળખ જનોઈથી થાય છે. જનોઈ એ તો બ્રાહ્મણનું આઈ કર્ડ છે. જનોઈથી જ બ્રાહ્મણ સમાજમાં જુદો તરી આવે છે.

દેશ વ્યક્તિના માથે દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ હોય છે. આ ઋણમાંથી મુક્ત થવાનો તથા ઋણની યાદ તાજ રહે તે માટે જનોઈ ધારણ કરવામાં આવે છે. જનોઈના તર તર ઋણ પણ દર્શાવે છે. વળી, આ વિશ્વ સત્ત્વ, રજસ, અને તમસ એ ત્રણ ગુણોનું બનેલું છે. તેમાંથી મુક્ત થઈ પરમાત્માના સ્વરૂપમાં ભળી જવા માટે કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ સાધનો છે. આવી ગંભીર ભાવના ઈડ આંગળ લંબાઈના ત્રેવડા કરેલા ત્રણ તાર પાછળ છુપાયેલી છે. વળી, આ ત્રણ તાર બ્રહ્મા, વિષણુ, મહેશનું સ્વરૂપ છે.

જનોઈ ધારણ કર્યા પછી તેનું ગૌરવ અને ગરિમા જગવવાની જવાબદારી પણ છે. શ્રાવણ માસની પૂનમે વિધિવત રીતે જનોઈ બદલવી જોઈએ. જનોઈની પવિત્રતા જગવાય તે માટે કૌટુંબિક સૂતક પુરું થાય પછી જનોઈ બદલવી જોઈએ. દર ચાર માસે અથવા જનોઈ તૂટી જાય તો બદલવી જોઈએ. કોઈના અખિન સંસ્કારમાં ગયા પછી ધરે આવી સ્નાન કરી જનોઈ બદલવી જોઈએ. ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ પુરું થયા પછી પણ જનોઈ બદલવી જોઈએ. જનોઈને પવિત્ર રાખવા મળ મૂત્રાદિ ત્યાગ કરતી વખતે જમણા કાન પર ચઠાવવી જોઈએ જેથી જનોઈનો નીચેનો ભાગ આપણી નાભિથી ઉપર રહે અને જનોઈ અપવિત્ર ન થાય. મળ મૂત્ર વિસર્જન પહેલાં જનોઈને કાનની ઉપર કસીને લાપેટી દેવામાં આવે છે. કાનની પાછળની બે નસોનો સીધો સંબંધ આંતરડાં સાથે હોય છે. આ હિયા આંતરડાં પર દબાણ ઊભું કરે છે જેના કારણે મળ વિસર્જનમાં સરળતા રહે છે

## “શોગ ઓઝ યુથ” બો ડૉ. કલામની દિપાચે ભાવાનુ વાદ

કુ. ઐન.વી. સૌરક્ષિય  
ઉદ્ઘા.માધ્ય.શીખાં

ટેકનોલોજી , જ્ઞાન અને દેશપ્રેમ થી સજ્જ ભારતના યુવા નાગરિક તરીકે નાનું લક્ષ્ય રાખવું ગુનો છે.

મૂલ્ય આધારિત તંત્ર અને આર્થિક સામર્થ્યની શક્તિ સાથે ભારતને વિકસિત રાષ્ટ્રમાં તબદીલ કરવાના મહાન લક્ષ્યને હાંસલ કરવા હું કામ કરીશ અને પરસેવો પાડીશ અબજો નાગરિકોમાંનો એક હું છું. માત્ર આ લક્ષ્ય જ અબજો આત્માને પ્રજવલિત કરશે.

તે મારામાં પણ પ્રવેશ્યું છે, અન્ય લોતની તુલનાએ પ્રજવલિત આત્મા પુઢીની ઉપર, નીચે કે અંદર આવેલા અન્ય સ્વોત કરતાં સૌથી વધુ શક્તિશાળી સ્વોત છે હું **વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને હાંસલ કરવાના જ્ઞાનના દિપને પ્રગટેલો રાખીશ**

જો આપણે પ્રજવલિત બુધ્યિ સાથે મહાન લક્ષ્યને હાંસલ કર્યા માટે કામ કરીશું અને પરસેવો પાડીશું તો તે રૂપાંતરથી ગતિશીલ વિકસિત ભારતનો જન્મ થશે

હું ઇશ્વરને પ્રાર્થના કરું છું : સું દરતા સાથેની દૈવી શાંતિ મારા લોકોમાં પ્રવેશો, આનંદ અને સ્વાસ્થ્ય આપણા તન-મન અને આત્મામાં મહોરી ઉકે.



# ખરેખર દેશભક્તિ એટલો શું



પી.બી. પ્રજાપત્રી  
ઉત્ત્ત્રા.માધ્યામેચ શિક્ષણ

સ્વાતંત્ર્ય પવો પર દેશભક્તિનો વશો તમામ ભારતીયોમાં સદાબદ્ધાર ખીલી ઉઠે છે બાકીના દિવસોમાં સ્વાતંત્ર્યવીરો અને દેશને યાદ કરવાની ભારતીયો પાસે જાણે ફુરસદ જ નથી

ખરેખર આપણી દેશભક્તિ જાણે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરવા પૂરતી જ સીમિત રહી ગઈ હોય એવું લાગતું હોય છે

આપણાં દેશમાં દેશભક્તો તો ઘણાં થઈ ગયા પણ એમાંના એક દેશભક્તનો પ્રસંગ આજે શેર કરવાનું મન થાય છે આ વાત છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની 1936 ના ઓલિમ્પિકની ફાઇનલ મેચ હોટ - ફેવરિટ ભારત જર્મની હતી. ભારતીય ટીમના કપ્તાન મેજર ધ્યાનચંદ પર સૌની નજર હતી અને એ મેચ જોવા મહારાજા સયાજુરાવ અને તેમના પત્ની પણ હજર હતાં પણ સૌથી મોટું આકર્ષણ જર્મનીના ચાન્સલર એડોલ્ફ હિટલર પણ હતા અને મેચ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ જે બનવાનું હતું તે જ બન્યું જાદુગરે જાદુ કરીને ફાઇનલ વ્હીસલ સુધી ફાઇનલ સ્કોર ભારત 8-1 થી મેચની સાથે ગોલ મેડલ પણ પોતાના નામે કર્યો

ત્યારબાદ ધ્યાનચંદની રમત જોઇને હિટલર ખૂબજ પ્રભાવિત થયા અને તેને પોતાની મેહલમાં મળવા બોલાવ્યો. પછી હિટલરે કહ્યુ કે, “ ધ્યાનચંદ , એક ભારતીય સેનાનો નાનો સુબેદાર અને આટલી સુંદર અને પ્રભાવિત રમત વાઝ...વાહ..... એક રમતવીરની તારા દેશને તારી કદરા નથી. જો તું અમારા દેશ (જર્મની) વતી રમવાનું પસંદ કરીશતો તને જર્મનીઝોજનો કર્નલની ઉપાધિ આપું”. હિટલરની ધાક સામે ભલભલા ડરી તેને પરો પડી જાય. પણ ધ્યાનચંદ તેમાંના ન હતાં. તેમણે જે જવાબ આપ્યો તે ખરેખર અનુસરવા જેવો છે તેમનો જવાબ હતો કે, હિટલર, મ�ेરે દેશ કી યે જિમ્બેદારી નહીં હૈ કી વો મુજે આગે બढાયે, પર યે મરી જિમ્બેદારી હૈ કી મેરે દેશ કો આગે બઢાઉ.

ખરેખર આવી દેશભક્તિ જો બધા દેશભક્તોમાં આવી જાય તો ભારતને મહાસત્તા બનતા કોઈ ન રોકી શકે. ‘આજાદ હિન્દુસ્તાન’ , એ “ વતન તને સલામ ”.



Bina D. Bhatt  
Sec. School Teacher

## शिक्षक दिवस पर (५ सितंबर) शिक्षक की व्याख्या

शि-शिक्षा भी दे सकें। क्षमा भी कर सकें। कृपा भी हो। जिसमें यह सब हो वह शिक्षक बाकी सभी निरर्थक।

दूसरा नाम मास्तर। यानि जिसका स्तर माँ जितना हो। और आखिर में गुरु जिसमें गुण हो, भले ही रूप न हो।

According to me the teacher is one who has following characteristics:TEACHER

T\_Tolerance

E\_Energetic

A\_Appreciate others

C\_Can Compromise

H\_Hopeful

E\_Enthusiastic

R\_Ready for any situation

One poem-

शिक्षक --देश का भविष्य।

विश्व की शोभा है शिक्षकों की वाणी  
हो शिक्षक तो सबका उज्ज्वल है भविष्य  
गुरु का पूजन करो प्रेम भाव से,

जो छात्रों का सिंचन करे अंतर भाव से।  
विश्व की शोभा.....

करे न वो जो गुरु ने बताया,  
जीवन वो जीया पर निरर्थक जीया।

विश्व की शोभा.....

शिक्षक है डोक्टर, इनजीनियर, अधिकारी का सर्जनहार  
है शिक्षक तो हो सबका उद्धार।

विश्व की शोभा.....

शिक्षक शक्ति है और सबका सहारा,  
शिक्षक नहीं तो कोइ नहीं तुम्हारा।  
विश्व की शोभा.....

शिक्षक बचाओ, देश बचाओ।



## અનેક શોળોમાં ઉપયોગી - ફૂધી



શૈલેષ્કમાર જનતિબાલ મહેતા,  
આચાર્યશ્રી, શ્રી એસ.કે.વી.વિધા

ફૂધીમાં અનેક ગુણો છે તેથી આરોગ્યને જાળવવા માટે ખૂબ ઉપયોગી છે ફૂધી, ફૂધ જેવા ગુણ ધરાવે છે. ફૂધીમાંથી પણ વનસ્પતિજન્ય ફૂધ મળે છે. ફૂધી ખોરાક તરીકે તમામ પ્રકૃતિવાળા લોકો માટે અનુકૂળ છે ફૂધી ઉનાળુપાક ગણાય છે ફૂધી તુંબડી-જાતની વનસ્પતિ છે અને વેલારૂપે થાય છે. વેલા છોડ ઉપર સફેદ ફૂલ આવે છે. ફૂધી બે જાતની થાય છે. (૧) મીઠી તુંબડી ફૂધી (૨) કડવી- ફૂધી

મીઠી તુંબડી - ફૂધી જે નાઈ તરીકે પણ ઓળખાય છે. તે ફૂધી, સુંવાળી છાલ ચમકતી આછા લીલી રંગની હોય છે. ફૂધીની અંદર મીઠો ગર્ભ-પોચા બીસાથે હોય છે. મીઠી ફૂધીનો ઉપયોગ શાકભાજુ અને ઔષધ તરીકે થાય છે. કડવી- ફૂધી સૂકાયા પછી નદી-તળાવોમાં તરવા માટે થાય છે. મીઠી ફૂધીનો ઉપયોગ શાક, ફલવો, રાયતુ, જ્યુસ, થેપલા વગેરે માટે થાય છે. મલાઈ વગરના ફૂધમાં ફૂધીને ખમણીને થોડા પ્રમાણમાં ખાંડ નાખી ખીર બનાવી ખાય શકાય છે. તેનો ઉપયોગ ફરાળ તરીકે કરી શકાય છે. ફૂધીના છીણને બાફીને ઠંડી કરીને દહીં સાથે રાયતુ તથા ફલવો બનાવી શકાય છે. તેના છીણમાંથી જ્યુસ-રસ બનાવી તેમાં લીંબુ વગેરે નાખીને પીવાથી એસિડિટી અને પેશાબની તકલીફો ફૂર થાય છે.

ફૂધી આરોગ્યની દ્રષ્ટીએ શીતળ રેચક, બળપ્રદ અને સ્નિગ્ધ છે. (૧) ફૂધીમાં સોડિયમ અને પોટેશિયમ તત્વો વધુ પ્રમાણમાં હોવાથી ફૂધીનું સેવન મીઠાના ઉપયોગ વગર કરી શકાય છે. (૨) ફૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી કબજીયાતના દર્દીઓએ ફૂધીનું શાક અને જ્યુસ લેવાથી ફાયદો થાય છે. (૩) પેશાબમાં બળતરા થતી હોય અને વારંવાર ઇન્ફેક્શન થતું હોય તે માટે ફૂધીનો રસ આલ્કોલાઇન હોવાથી એસિડિક પેશાબમાં દર્દીઓને રાહત થાય છે. (૪) પેટના દર્દો, ડાયાબિટીસ અને હદયરોગના દર્દીઓએ ફૂધીના જ્યુસનું સેવન કરવાથી રાહત થાય છે. (૫) ઉનાળામાં ગરમીને કારણે માથાના દુખાવામાં માથા ઉપર ફૂધીને ચીરીને લગાડવાથી અને પગના તળીયામાં બળતરામાં ફૂધીની માલીશ ઉપકારક છે. (૬) લીવરના દર્દીઓને અને અકાળે માથાના કાળા વાળ સફેદ થતા હોય તો નયણા કોઠે ફૂધીનું જ્યુસ લેવાથી ફાયદો થાય છે. (૭) ફૂધીનો ગર્ભ ફૂધીના કુમળા વેલ-પાનનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. તાવ મગજમાં ચડી ન જાય તે માટે ફૂધીના છીણને માથે-કપાળે બાંધવાથી રાહત થાય છે. ફૂધીના પાંદડાનો ઉપયોગ હરસ-મસા મટાડવામાં અને ફૂધીના બીનો ઉપયોગ મગજ માટેની દવા બનાવવામાં થાય છે.

ફૂધીનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી શરીર નીરોગી અને તંદુરસ્ત રહે છે.



## ગાંધી હદ્યની વેદળા



ગગનમાં મેઘ નથી, ના વાદળ, ના વર્ષા  
 હદ્યના આંગણામાં પાંપણોના છાપરાં કેમ ટપકે છે  
 કોણે સજ્યા ? કોણે માટે ? બાપુની આંખમાં જળબિન્દુ ?  
 હાથે લાકડી પરો ચાખડી ઉતાવળે પગાલે ઢોડી જાય.  
 એણે ફૂરથી જ સાંભળી લીધી છે દીન દરિદ્રની દારૂણ હાય !

કેડે વસ્ત્ર ન કાંધે ઉપરણું બાકી અંગ ઉધાડા છે  
 સંકેત છે સૌને માટે દેશમાં પચાસ પ્રતિશત ઉધાડા છે !

પોકાર છે હાયનો - રાજ છે પણ નિતિ નથી લોક છે પણ નીતિ નથી  
 રાજ પ્રજા વચ્ચે સત્તાનો જુગાર ચાલે છે છલકપટની હરીકાઇ  
 સત્તાની મદિરા સૌ માંગો, સત્યામૃત પીવા તૈયાર ના કોઈ  
 ખારાં ઝરણા ફૂટી નીકળ્યા લોકશાહીની વાવડીઓમાં  
 કયાંથી લાવશો મીઠા પાણી પાર્ટીઝુપી બાલ્ટીઓમાં  
 ધાવણાહારાં દારુ માંગો કયાંથી ફૂટે દફીં ફૂધના ઝરણાં  
 જનતા માંગો ધૂળ ધુમાડો, ટ્રેકટરોને ફેકટરીઓ તણાં  
 જનતા જપે છે મંત્ર નવો ( હિન્દીમાં બે વાક્ય લખવાના છે )

જોઈ બાપુઅકળાયા સ્વરાજ્ય અપાવી પછ્યતાયા  
 સ્વરાજ્ય તો છે કાચો માલ, સુરાજ્યમાં કોણ બદલશે ?  
 જ્ઞાનોદ્યના સૂરજ વિના સર્વોદ્યનું રૂપ કયાંથી દેખાશે  
 જનતા જ્ઞાનવિના અંધી એ તો બહેરી, ગુંગી, લંગડી  
 સર્વોદ્યનું સર્વોચ્ચ શિખર કેમ જાશે ચડી ?

ગગનમાં મેઘ નથી, ના વાદળ, ના વર્ષા  
 હદ્યના આંગણામાં પાંપણોના છાપરાં કેમ ટપકયાં

# શાળા બી પ્રોવિશો





મૌની સ્ક્યુલર્સ સેન્ટર  
મદ્દે શિક્ષકોની મુલાકાત



રક્ષાબંદન પર્વ નિમિલો  
રાહડી તેમજ નિબંધ સ્પર્ધા







ઘોરણા - ૧૦ રાત્રા ઘોરણા - ૧૨  
મોટીવેશાલ કાર્યક્રમ

શાનિવાર ની પ્રવૃત્તિ





ન.એમ.ડી.શી. લી  
શી.એસ.આર. પ્રવૃત્તિ અંગર્ય  
ધો.૧૧ અને ધો.૧૨ માટે કારકીર્દી માર્ગદર્શિકા

## શૈક્ષણિક પ્રવાસ

